



Pictures' Source: Students of TISS

ભારીવાળા અને ફેરિયાઓ નું સંગઠન અને ટ્રાફિક વ્યવસ્થા

- **Who** are they?
(તેઓ કોણ છે?)
- **What** is the vision?
(વિજન શું છે?)
- **How** should we move towards the vision?
(વિજન તરફ આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ?)

WHO ARE THEY?


WHO ARE THEY?



WHO ARE THEY?

વાસિમ ખાન, પુરુષ, 27, જીલ્લા રામપુર, ઉત્તર પ્રદેશ

- છ મહિના પહેલાં ભુજને ભુજમાં પ્રવેશવા માટે તેમના ભાઈ સાથે જોડાવા માટે ખસેડ્યો.
- તેમણે તેમના વિકેતા વ્યવસાય સાથે ભારતભરમાં પ્રવાસ કર્યો છે અને તે જ્યાં મુસાફરીની તકો છે ત્યાં જવા માટે તૈયાર છે.
- ગાદલા, કાગળ, પથારી અને ધાબળા વેચે છે.
- કર્મચારીઓ 6-10 લોકો, તેમના ખોરાક અને રહેઠાણને બાદ કરતા લગભગ 6000 INR ચૂકવે છે.
- ઉત્તર પ્રદેશના ગામડાઓમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત મોટા ભાગના સ્ટોક





અરવિંદ કરિક્યા, પુરૂષ, 19, દક્ષિણ ગુજરાત

- છેલ્લા 5 વર્ષથી ભુજમાં રહેવું.
- તેના કાકા સાથે 12 પર વેન્ડિંગ શરૂ કર્યું અને હવે તેના વેપારની તમામ યુક્તિઓ જાણે છે.
- શિયાળા દરમિયાન જ્યુબિલી સર્કલ નજીક જૂના ઊનીને વેચે છે, પરંતુ હમીરસર તળાવની પાસે એક વર્ષ પૂરું થવાનું વલણ છે જ્યાં તે મહિલાના કપડાં વેચે છે.
- પીક સીઝન દરમિયાન લગભગ 10 લોકો રોજગારી આપે છે
- રાજકોટ અને અમદાવાદમાં કામ કર્યું
- મૂંઝવણને કારણે એક લાખને નુકસાન થયું
- દર મહિને 15 થી 25 કિ વચ્ચેની કમાણી
- ભૂતકાળમાં એક મહિલાની અવધિ માટે સામનો કરવો પડ્યો હતો

વસુબેન, સ્ત્રી, 45, દિલ્હી


- છેલ્લાં 20 વર્ષથી ભુજ સાથે આવે છે
- બહેનો, ભાઈ અને પુત્ર સાથે કૌટુંબિક વ્યવસાયમાં કામ કરે છે.
- હાજીર કા મેલા પછી 3 મહિના માટે ભુજ આવે છે
- સનગ્લાસ અને કેપ્સ વેચે છે, માત્ર ઉનાળાના મહિનાઓ માટે
- વેન્ડિંગના સમગ્ર સમયગાળા માટે ફુટપાથ પરના જીવન
- તેના પુત્ર સાથે કામ કરે છે
- રાજકોટ અને અમદાવાદમાં કામ કર્યું
- દર મહિને 4.5-5 કીનો નફો બનાવે છે

*A street vendor/hawker is a person who offers goods for sale to the public at large **without having a permanent structure/place** for his activities.*


*Some street vendors/hawkers are **stationary** in the sense that they occupy space on pavements or other public/private places while others are **mobile** in the sense that they move from place to place carrying their wares on push carts or baskets on their heads.*

- It is estimated that there are about **1 crore vendors** in the country.
- NSSO (1993-94) estimates the proportion of street vendor population as follows:
 - Urban Areas: **0.89%** of the population
 - Rural Areas: **0.27%** of the population
- On an average a vendor earns a meagre **Rs 40 to Rs 80 per day**.
- About to **10% to 20%** of vendors' income goes to **bribes** and other such levies.
- There are studies that have stated that in addition to **lack of social and economic security**, there are several **health related issues** that are faced by vendors, which include the following:
 - Migraine
 - Hyper-acidity
 - Hyper-tension
 - High blood pressure etc.

Estimated Employment Generation
અંદાજિત રોજગાર



Annual Turnover (in Rs crore)
વાર્ષિક ટર્નઓવર



REPORTABLE

IN THE SUPRME COURT OF INDIA
CIVIL APPELLATE JURISDICTION

Civil Appeal Nos.4156-4157 of 2002
WITH
Civil Appeal Nos. 4161-4162 of 2002
AND
Civil Appeal Nos. 4175-4176 of 2002
AND
I.A.Nos.266-285, 288-289, 294-299, 304-309, 312-321 & 324-335
IN
Civil Appeal Nos.4156-4157 of 2002
AND
I.A.Nos.7-8 in Civil Appeal Nos. 4161-4162 of 2002
AND
I.A.Nos.16-17 in Civil Appeal Nos. 4175-4176 of 2002

Maharashtra Ekta Hawkers Union and another ... Appellants
Versus
Municipal Corporation, Greater Mumbai and others ... Respondents

JUDGMENT
ORDER


G.S. SINGHYL J.

1. A street vendor / hawkker is a person who offers goods for sale to the public at large without having a permanent structure / place for his activities. Some street vendors / hawkkers are stationary in the sense that they occupy space on the pavements or other public / private places while others are mobile in the sense that they move from place to place carrying their wares on push carts or in baskets on their heads.

Page 1


**Support to
Urban Street Vendors**
(Operational Guidelines)

National Urban Livelihoods
Mission


Government of India
Ministry of Housing & Urban Poverty Alleviation

Printed in December 2013

REGISTERED NO. 81—(V.04/0007/2003)—14


भारत का राजपत्र
The Gazette of India

अवधभाग
EXTRAORDINARY
भाग II — खण्ड 1
PART II — Section 1
अधिकार से प्रकाशित
PUBLISHED BY AUTHORITY

कं. 8] शनिदिने, बुधवार, मार्च 5, 2014/ फाल्गुन 14, 1935 (शक)
No. 8] NEW DELHI, WEDNESDAY, MARCH 5, 2014/PHALGUNA 14, 1935 (SAKA)

इस भाग में निम्न पृष्ठ संख्या दी जाती है जिससे कि यह अलग संकलन के रूप में रखा जा सके।
Separate paging is given to this Part in order that it may be filed as a separate compilation.

MINISTRY OF LAW AND JUSTICE
(Legislative Department)

New Delhi, the 5th March, 2014/Phalguna 14, 1935 (Saka)

The following Act of Parliament received the assent of the President on the 4th March, 2014, and is hereby published for general information:—

**THE STREET VENDORS (PROTECTION OF LIVELIHOOD AND
REGULATION OF STREET VENDING) ACT, 2014**
(No. 7 of 2014) [4th March, 2014]

An Act to protect the rights of urban street vendors and to regulate street vending activities and for matters connected therewith or incidental thereto.

BE it enacted by Parliament in the Sixty-fifth Year of the Republic of India as follows:—

CHAPTER I
PRELIMINARY

1. (1) This Act may be called the Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014.
(2) It extends to the whole of India except the State of Jammu and Kashmir.

Short title,
extent,
commencement
and
provisions.

Supreme Court Ruling, Sept 2013
सुप्रीम कोर्ट निर्णय, सप्टेम्बर 2013

SUSV Scheme (Central) for Vendors, Dec 2013
वेन्डर्स माटे एस.यु.एस.वी. स्कीम
(सेन्ट्रल), डिसेम्बर 2013

Street Vendors Act, 2014
शेरी विक्रेताओ अक्ट, 2014

Extra No. 584

વાર્ષિક લવાજમનો દર રૂ. ૩૫૦૦/-



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LVII] TUESDAY, OCTOBER 18, 2016/ASVINA 26, 1938

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

URBAN DEVELOPMENT AND URBAN HOUSING DEPARTMENT

Notification

Sachivalaya, Gandhinagar, 18th October, 2016

Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014.

No: GH/H/ 186 of 2016/NLM/102016/302/H:— The following draft of rules which is proposed to be issued under Section 36 of the Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014 is published as required by sub-section (1) of the said section 36 of the Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014 for the information of all the persons likely to be effected thereby and notice is hereby given that the said draft of rules will be taken into consideration by the Government of Gujarat from or after expiry of thirty days from the date of publication of this notification in the *Official Gazette*.

2. Any objections or suggestions which may be received by the Additional Chief Secretary to the Government of Gujarat, Urban Housing and Urban Development Department Sachivalaya, Gandhinagar from any person with respect to the said draft on or before the expiry of the aforesaid period will be considered by the Government of Gujarat

DRAFT NOTIFICATION

Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014.

No:GH/H/ 186 of 2016/NLM/102016/ 302/H:— In exercise of the powers conferred by section 36 of the Street Vendors (Protection of Livelihood and Regulation Street Vending) Act, 2014, the Government of Gujarat hereby makes the following rules, **namely:-**

WHAT IS THE VISION?

WHAT IS THE VISION?



WHAT IS THE VISION?



WHAT IS THE VISION?

1. Resettlement of weaker sections outside the city to unserved places like Savda Ghevra, Bhalsawa etc.
2. Lack of basic facilities and sense of self-pride in life at inner city slums.
3. Removal of hawkers and vendors (who are eyes on streets).



WHAT IS THE VISION?

1. Inclusive planning - Integrate all income groups into community planning and design.
2. Provide shared social amenities and physical infrastructure within inclusive communities.
3. **Provide designated space for hawkers and vendors (who are eyes on streets).**





WHAT IS THE VISION?




WHAT IS THE VISION?



TOWARDS THE VISION- BHUJ


TOWARDS THE VISION- BHUJ



- STUDY AREA 1
- STUDY AREA 2
- STUDY AREA 3
- STUDY AREA 4
- STUDY AREA 5

- ARRANGED AS PER DECREASING INTENSITY OF VENDING ACTIVITIES
- THE ROADS MAPPED FOR THE STUDY ARE MARKED BOLD IN BLACK

TOWARDS THE VISION- BHUJ



KEY PLAN

LOCATION MAP

IDENTIFIED ROADS FOR PROPOSAL

(PROPOSED 1km WIDE ROAD)

MIRZAPUR HIGHWAY
(PROPOSED 30m WIDE)

D.S.P. RESIDENCE

JUBILEE CIRCLE

VIJAY NAGAR

JUBILEE GROUND

IRRIGATION DEPARTMENT

SEMAR ROAD
(PROPOSED 30m WIDE)

G.B. COLONY

BANKERS COLONY

HIMATNAGAR COLONY


BHUJ HAAT

RELIANCE MALL


BHANUSHALI NAGAR

BHUJ HUNDRA ROAD
(PROPOSED 30m WIDE)


TOWARDS THE VISION- BHUJ



Road-side Local Land Use









- RESIDENTIAL
- RECREATIONAL (Including open areas)
- COMMERCIAL
- MIXED USE
- PUBLIC AND SEMI-PUBLIC SPACES



LOCAL LAND USE MAP



TOWARDS THE VISION- BHUJ







-  INFORMAL PRIVATE PARKING
-  AUTO PARKING
-  CONGESTION DUE TO BUS STOPPAGE
-  ROAD SIDE VENDORS


IDENTIFIED ISSUES

TOWARDS THE VISION- BHUJ




-  INFORMAL PRIVATE PARKING
-  AUTO PARKING
-  CONGESTION DUE TO BUS STOPPAGE
-  ROAD SIDE VENDORS

IDENTIFIED ISSUES





TOWARDS THE VISION- BHUJ

OVERALL TRAFFIC COMPOSITION




- Two Wheeler
- Private Car
- Auto Rickshaw
- Three Wheeler
- Bus
- Trucks
- Donkey Cart
- Bicycle
- Pedestrian




ROAD SECTIONS & TRAFFIC CAPACITY ANALYSIS- SUMMARY

TOWARDS THE VISION- BHUJ




2016-17 2015-16 2016-17 2015-16
 MORNING EVENING

MORNING VENDORS




- Closed Stalls
- Eateries Vendors
- Vegetables
- Car Repairing
- Paan
- Barbers
- Snacks
- Laundry
- Cobbler
- Chappal


EVENING VENDORS



- Closed Stalls
- Eateries Vendors
- Vegetables
- Car Repairing
- Paan
- Barbers
- Snacks
- Laundry
- Cobbler
- Chappal




TOWARDS THE VISION- BHUJ



ROUTE E2 ROAD SECTION


Bhuj Haat Site was chosen as a prototype site for formalisation. Interventions:

- Re-organising and utilising available land efficiently
- Reassigning vendor spaces
- Construction of seating spaces
- Provision of necessary services




VENDOR FORMALISATION: BHUJ HAAT SITE

TOWARDS THE VISION- BHUJ



ROUTE E2 PROPOSED ROAD SECTION



ROUTE E2 PROPOSED ROAD PLAN

VENDOR FORMALISATION: BHUJ HAAT SITE

TOWARDS THE VISION- BHUJ



TOWARDS THE VISION- BHUJ



Survey at Bhuj Haat site



Visit by students of TISS, Mumbai regarding vendors in the city



Discussion with representatives



Presentation of the work done in front of citizens



CURRENT ACTIVITIES (ચાલુ પ્રવૃત્તિઓ)

Study of the streets as public spaces
જાહેર સ્થળો તરીકે શેરીઓમાં અભ્યાસ

Formation of TVC and beginning of vendor survey
શહેરી લારીવાલાઓની સમિતિની રચના અને લારીવાળાઓનું સર્વેક્ષણ

શહેરી લારીવાલાઓની સમિતિની રચના અને લારીવાળાઓનું સર્વેક્ષણ





JUBILEE
GROUND

NULM યોજનાના SUSV ઘટક શહેરી સ્થાનિક સરકારી સંસ્થાઓ (યુ.એલ.બી.) દ્વારા શહેરમાં લારીવાળાઓ ની આજીવિકાના મુદ્દાઓને સંબોધવા માટેની માર્ગદર્શિકાને સ્પષ્ટ કરે છે. આ ઘટકનો ઉદ્દેશ નીચે પ્રમાણે છે:

- લારીવાળાઓનું **સર્વેક્ષણ** અને ઓળખ કાર્ડનો મુદ્દો
- **શહેરી લારીવાલાઓની સમિતિની** રચના અને તેમને સંગઠિત કરવા માટે શહેર નું આયોજન
- શહેરમાં વેન્ડિંગ ઝોનનું વિકાસ
- તાલીમ અને કૌશલ્ય વિકાસ
- આર્થિક સમાવેશ
- વ્યવસાય માટે નાણા ની વ્યવસ્થા
- સામાજિક સુરક્ષા માટેની યોજનાઓ સાથે જોડાણ

DISTRICT
COLLECTOR
Constitutes
15 Members
for the TVC

OFFICIAL MEMBERS

CHIEF OFFICER NAGAR PALIKA (CHAIRPERSON)



MEDICAL OFFICER



POLICE INSPECTOR/POLICE-SUB-INSPECTOR



TOWN PLANNING OFFICER



MUNICIPALITY OFFICER (MEMBER-SECRETARY)



NON-OFFICIAL MEMBERS

MEMBER OF MUNICIPALITY



ELECTED REPRESENTATIVES OF VENDORS



MEMBER FROM MARKET & TRADE ASSOCIATIONS



MEMBER FROM NGO/CBO/RWA



REPRESENTATIVE OF NATIONALIZED LEAD BANK



How the Election Process Works



Notification regarding TVC elections are published in the local newspaper or journals.



List of nominees are submitted from amongst the vendor population.



In case more vendors are listed than necessary, a **show of hands** by the vendor organisations, in the presence of the Chairman, leads to selection in the TVC.



The nominees submit **relevant documents**. The concerned authority appoints eligible vendors to the TVC.

What are your duties?



TVCs should carry out a **survey** of all existing street vendors atleast once in 5 years



>No **eviction** or relocation till survey is carried out



Anyone above the age of 18 shall be **issued certificate** of vending

Street Vendors shall give an undertaking to the TVCs



All certified vendors shall pay **vending fees** for renewal on payment of fees



Vending certificates shall be **transferred** to spouse or child of deceased vendor



Vendors who have been issued certificates must also be issued **identity cards** by the TVC



Every Street Vendor shall maintain, cleanliness, public hygiene, civic amenities and public property in the vending y zone.



After issuance of the certificate no vendor shall be relocated or evicted from the specified place without **30 days notice**

Seized goods shall be released
 > Within working days for non-perishable goods
 > on same day for perishable goods



A civil judge or judicial magistrate shall lead the committee for **redressal of grievance** or resolution of disputes

> There should be atleast one TVC per zone or ward
 > Once in every 5 years the local authority on the recommendations of the TVC shall prepare a plan to promote the vocation of Street Vendors

TVCs shall publish Street Vendor's **charter** and data-base and carrying out of social audit



Prevention of harassment by police and other authorities for vendors abiding to terms and conditions of vending certificate

Penalty of 2000/- imposed on any street vendor who contravenes any terms and conditions of the vending certificate

Know your Rights!

What work has to be done?



Appropriate government may organise research, training and awareness programmes for the street vendors

